

ત્વરિત જાહેરાત માટે

બ્રેમ્પટનમાં તમામ પર્યાવરણીય પરિવર્તન કરનારાઓને કોલ આપવામાં આવે છે!

સેન્ટર ફોર કમ્યુનિટી એનર્જી ટ્રાન્સફોર્મેશનમાં બોર્ડ મેમ્બર તરીકે જોડાઓ; ગ્રો ગ્રીન એવોર્ડ્સ માટે કોઈ વ્યક્તિ અથવા વ્યવસાયને નોમિનેટ કરો

બ્રેમ્પટન, ઓન્ટારિયો (02 ફેબ્રુઆરી 2022) – સીટી ઓફ બ્રેમ્પટનમાં વ્યક્તિઓ, વ્યવસાયો અને સમાજની સંસ્થાઓ માટે નવી તકો છે.

સેન્ટર ફોર કમ્યુનિટી એનર્જી ટ્રાન્સફોર્મેશન (CCET)

બ્રેમ્પટન સીટી કાઉન્સિલે CCET એડવાઈઝરી ટાસ્ક ફોર્સની ભલામણોને સર્વાનુમતે મંજૂર કરી છે જેમાં સામેલ છે નવા CCET બજેટ તરફ \$300,000 ની રકમમાં પર્યાવરણીય માસ્ટર પ્લાન કેપિટલ બજેટમાંથી હાલના મૂડી ભંડોળની પુનઃ ક્ષણવાણી. આ ભંડોળ CCET ને પ્રસ્થાપિત કરવામાં મદદ કરશે અને તેમના પ્રચલનના પ્રથમ વર્ષમાં સમર્થન આપશે જેથી સિટી પરિવર્તનલક્ષી આબોહવા અંગે પગલા લઈ શકાય. સંપૂર્ણ અહેવાલ જોવા માટે અહીં મુલાકાત લો www.brampton.ca/CCET.

મંજૂર કરેલ ભંડોળ સાથે, CCET હવે બિન-નફાની સંસ્થામાં CCETને ઔપચારિક રીતે સ્થાપિત કરવામાં મદદ કરવા માટે ટ્રાન્ઝિશનલ બોર્ડ પર સ્વેચ્છાથી સેવા આપવામાં રસ ધરાવતા જુરસાદાર વ્યક્તિઓની શોધ કરી રહ્યું છે.

આ કૌશલ્ય-આધારિત શાસન બોર્ડમાં સ્વયંસેવક ધોરણે નવ સભ્યો અને સિટી સ્ટાફના પાંચ લોકો પૂરક તરીકે રહેશે. સ્વયંસેવક બોર્ડ CCETના રોજિંદા વ્યવસ્થાપન માટે જવાબદાર રહેશે.

અરજી આપવાની અંતિમ તારીખ 25 ફેબ્રુઆરી 2022 છે. સંપૂર્ણ વિગતો મેળવો અને બોર્ડ સભ્યની અરજી અહીં રજૂ કરો www.brampton.ca/CCET.

ગ્રો ગ્રીન એવોર્ડ્સ

બ્રેમ્પટનના નવા ગ્રો ગ્રીન એવોર્ડ્સ માટે કોઈ વ્યક્તિ, વ્યવસાય અથવા સંસ્થાને નોમિનેટ કરો! આ પુરસ્કારો સમગ્ર બ્રેમ્પટનમાં ઉત્કૃષ્ટ વ્યક્તિઓ, વ્યવસાયો અને સંસ્થાઓને સન્માનિત કરશે જેમણે પર્યાવરણીય આગેવાની પ્રદર્શિત કરી હોય અને એક સ્વસ્થ ટકાઉ અને સ્થિતિસ્થાપક બ્રેમ્પટનના સર્જન માટેના ગ્રો ગ્રીનના સ્થાપિત તેમજ કુદરતી પર્યાવરણોના સંરક્ષણ, વિકાસ અને સંતુલિત કરવાના વિઝનમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હોય.

પારિતોષિકના ચાર વર્ગોમાં સામેલ છે:

- **ક્લાર્ટમેટ ચેન્જ એવોર્ડ** – એવા વ્યક્તિ અને વ્યવસાય/સંસ્થાને પ્રદાન કરવામાં આવે છે જેમણે ક્લાર્ટમેટ ચેન્જ એટલેકે આબોહવાના પરિવર્તનમાં ઘટાડો લાવવાના પ્રયાસો અને/અથવા આબોહવાના પરિવર્તનના અનુકૂલન અંગેની જાગૃકતા/જાણકારી ઊભી કરવાના પ્રયાસોમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હોય.
- **સ્ટિવર્ડશીપ એવોર્ડ** – એવા વ્યક્તિ અને વ્યવસાય/સંસ્થાને પ્રદાન કરવામાં આવે છે જેમણે વૃક્ષોના સંરક્ષણ અને/અથવા સ્ટિવર્ડશીપ, કુદરતી વારસાની વ્યવસ્થા, પાણી અને/અથવા કચરાના ઘટાડાને લગતી પહેલ સંબંધિત પર્યાવરણીય ટકાઉપણાને ઉન્નત કરવા માટે નોંધપાત્ર રીતે યોગદાન આપ્યું હોય.
- **એન્વાયર્મેન્ટલ યુથ એવોર્ડ** – એવા વ્યક્તિ અને વ્યવસાય અથવા યુવા સંસ્થાને પ્રદાન કરવામાં આવે છે જેમણે બ્રેમ્પટનમાં પર્યાવરણીય સંરક્ષણ, આબોહવા પરિવર્તનની ક્રિયાઓ અને/અથવા ટકાઉપણું ઉન્નત કરવામાં અપવાદરૂપ સિદ્ધિ પ્રદર્શિત કરી હોય.
- **એન્વાયર્મેન્ટલ લિગસી એવોર્ડ** – એવા વ્યક્તિને પ્રદાન કરવામાં આવે છે જેમણે એક સ્વસ્થ, સ્થિતિસ્થાપક અને ટકાઉ શહેર બનાવવા માટે આપણા કુદરતી અને નિર્મિત વાતાવરણને બચાવવા, વધારવા અને સંતુલિત કરવાના ગ્રો ગ્રીન વિઝનને ઉન્નત કરવા માટે ઉત્કૃષ્ટ વ્યક્તિગત સેવા પ્રદાન કરી હોય અને તેમનું યોગદાન ચાલતું રહ્યું હોય.

અરજી આપવાની અંતિમ તારીખ 28 ફેબ્રુઆરી 2022 છે. જાહેર આરોગ્ય માર્ગદર્શિકાને અનુસરીને, 2022ની વસંતઋતુમાં વ્યક્તિગત રીતે અથવા વર્ચ્યુઅલ રીતે એવોર્ડ સમારંભ યોજવામાં આવશે. એવોર્ડ એટલેકે પુરસ્કારો વિશે વધુ વિગતો માટે અને નોમિનેશન ફોર્મ ભરવા માટે, [અહીં ક્લિક કરો](#).

સુવાક્યો

“બ્રેમ્પટન એક હરિત શહેર છે અને ટકાઉપણુંમાં અગ્રેસર છે, આપણા સમાજમાં રહેલા પર્યાવરણના હિમાયતીઓનો આભાર માનવો જ રહ્યો. જો તમે એવા કોઈ વ્યક્તિને જાણતા હોવ જેઓ બ્રેમ્પટનમાં ટકાઉપણા માટેના તેમના યોગદાન માટે સનમાનના હકદાર હોય તો તેમને ગ્રો ગ્રીન એવોર્ડ્સ માટે નોમિનેટ કરશો. જો તમને બોર્ડ સભ્ય તરીકેનો અનુભવ હોય તો CCET બોર્ડ ઓફ ડિરેક્ટર્સ માટે અરજી કરશો.”

- *પૅટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રેમ્પટન*

“અમે ગ્રો ગ્રીન એવોર્ડ્સ માટેના નોમિનેશનોના તેમજ CCET બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સ્તર જાણવા આતુર છીએ. બ્રેમ્પટન સીટી કાઉન્સિલ 2050 સુધીમાં બ્રેમ્પટનમાં પેદા થતા ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનને 80 ટકા જેટલું ઘટાડવા માટે અમારી યાત્રામાં આપણા શહેરના કાર્બન પદચિહ્નને ઘટાડવા માટે સમર્પિત છે. આ પરિવર્તનનો ભાગ બનવા અમારી સાથે જોડાઓ.”

- *પૉલ વિસેન્ટ, પ્રમુખ, પબ્લિક વર્ક્સ એન્ડ એન્જિનિયરિંગ; રિજનલ કાઉન્સિલર, વૉર્ડ 1 અને 5, સીટી ઓફ બ્રેમ્પટન*

CEERP અને ટર્મ ઓફ કાઉન્સિલમાં રેખાંકિત છે તે અનુસારના વધુ હરિત શહેર બનાવવાના અમારા ધ્યેયને ગ્રો ગ્રીન એવોર્ડ્સ અને CCET બોર્ડ ઓફ ડિરેક્ટર્સનું સમર્થન છે. અમે આ તકો દ્વારા વૈશ્વિક ક્લાર્ટમેટ ચેન્જમાં બ્રેમ્પટનના યોગદાનને ઘટાડવામાં મદદ કરવા માટે તમામ ક્લાર્ટમેટ ચેન્જ આગેવાનોને આમંત્રિત કરીએ છીએ અને અન્ય લોકોને પણ આવું કરવા પ્રેરિત કરીએ છીએ.”

- ડુગ વ્હિલાન્સ, સિટી કાઉન્સિલર, વોર્ડ 2 અને 6, સભ્ય, એનવાયર્નમેન્ટ એડવાયઝરી કમિટી; સભ્ય, CEERP કમ્યુનિટી ટાસ્ક ફોર્સ, સિટી ઓફ બ્રમ્પટન

સીટી ઓફ બ્રમ્પટન અમારા ક્લાઈમેટ ચેન્જના લક્ષ્યોને પૂર્ણ કરવા અને આપણા સમુદાયમાં જેઓ ટકાઉપણું સુધારવા અને આપણા પર્યાવરણીય ધોરણોને વધારવા માટે પ્રયાસ કરે છે તેમને ઓળખવા માટે સમર્પિત છે. Brampton.ca પર વધુ જાણો, ગ્રો ગ્રીન એવોર્ડ્સ માટે કોઈને નોમિનેટ કરો અથવા CCET બોર્ડ ઓફ ડિરેક્ટર્સ માટે અરજી રજૂ કરો."

- ડેવિડ બારિક, ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર (David Barrick, Chief Administrative Officer), સિટી ઓફ બ્રમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 7,00,000 લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca

મિડિયા સંપર્ક (MEDIA CONTACT):

સીટી ઓફ બ્રમ્પટન મલ્ટિકલ્ચરલ મિડિયા

multiculturalmedia@brampton.ca